

ફેબ્રુઆરી 13, 2018

**એ જ ચરિયાતું બજાર, એ જ મહાન સ્થળ**  
**ડાઉનટાઉન બ્રામ્પટન ફાર્મર્સ માર્કેટ 2018 માં મેઈન સ્ટ્રીટ પર નિર્ધારિત**

બ્રામ્પટન, ઓન્ટેરિયો - 2018 નું ડાઉનટાઉન બ્રામ્પટન ફાર્મર્સ માર્કેટ શનિવાર, જૂન 16 નાં રોજ ખુલવાનું નિર્ધારિત થયું છે, અને શનિવાર, સપ્ટેમ્બર 1 નાં રોજ, લેબર ડે સુધી, સવારના 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ડાઉનટાઉન બ્રામ્પટનમાં મેઈન સ્ટ્રીટ પર ચાલુ રહેશે.

ફાર્મર્સ માર્કેટ પછી 2018 નું હાર્વેસ્ટ માર્કેટ (લાણણી બજાર) શરૂ થશે જેની ઋતુ મુજબ વહેલી શરૂઆત શનિવાર, સપ્ટેમ્બર 8 નાં રોજ - લેબર ડેની લાંબી અઠવાડિક રજા પછી એક અઠવાડિયાના સમયમાં થશે. હાર્વેસ્ટ માર્કેટ આ વર્ષે નવા સ્થળે - રોઝાલી પાર્ક (કેન ગિલ્લવન્સ ડ્રાઈવ અને ચર્ચ સ્ટ્રીટ ઈસ્ટ પર) - અને શનિવાર, નવેમ્બર 3, 2018 સુધી સવારના 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે.

આ ફેરફારો પાછળનું કારણ ડાઉનટાઉન રિઈમેજિન્ગ પ્રોજેક્ટ છે જે રીજીયન ઓફ પીલ સાથેના સહયોગમાં શરૂ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ વોટરમેઈન્સ (પાણીની મુખ્ય લાઈનો) અને સીવર્સ (ગટરો) જેવી વર્ષો જૂની માળખાગત સગવડો બદલી નાખશે, અને ડાઉનટાઉન સ્ટ્રીટસ્કેપનો પુનરોદ્ધાર કરશે. આ પ્રોજેક્ટનું બાંધકામ 2018 ની પાનખર ઋતુમાં શરૂ થાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સુધારેલી શરૂઆત તારીખથી આ વર્ષે ફાર્મર્સ માર્કેટ - મેઈન સ્ટ્રીટ નોર્થ અને સાઉથમાં સપ્ટેમ્બર 1 સુધી ચાલુ રાખવાનું શક્ય બનશે.

**તમામ ધંધાદારી વિક્રેતાઓ**

શું તમે બ્રામ્પટન માર્કેટમાં વેચાણ કરવામાં રસ ધરાવનાર કોઈ ખેડુત કે વિક્રેતા છો? બ્રામ્પટન શહેરના બજારો માટેની અરજીઓ સ્વીકારવાનું સોમવાર, ફેબ્રુઆરી 12 નાં રોજ શરૂ થશે. કૃપા કરી નીચે યાદીબદ્ધ બજાર વિકલ્પોની સમીક્ષા કરો અને વિક્રેતા અરજીઓ માટે વેબસાઈટ જુઓ: [www.brampton.ca](http://www.brampton.ca)

**ડાઉનટાઉન બ્રામ્પટન ફાર્મર્સ માર્કેટ અને આર્ટિસ્ટ માર્કેટ - દર શનિવારે - જૂન 16 થી સપ્ટેમ્બર 1, 2018 સુધી**

- ખેડુતો (પરંપરાગત અને સેન્ટ્રલ સહિત)
- ખાદ્ય પદાર્થ ઉત્પાદકો
- કુશળ કારીગરો-ધંધાદારીઓ
- હસ્તકળા વસ્તુઓ
- દુર્લભ ચીજવસ્તુઓ

**માઉન્ટ પ્લીઝન્ટ વિલેજ માર્કેટ - દર ગુરુવારે - જૂન 21 થી ઓક્ટોબર 4, 2018 સુધી**

- ખેડુતો (પરંપરાગત અને સેન્ટ્રલ સહિત)
- ખાદ્ય પદાર્થ ઉત્પાદકો (હલાલ સહિતના)
- કુશળ કારીગરો-ધંધાદારીઓ

ખેડુતોના બજારને લગતી અદ્યતન માહિતી માટે વેબસાઈટ જુઓ, [www.brampton.ca/events](http://www.brampton.ca/events). ડાઉનટાઉન રિઈમેજીન્ડને સંબંધિત માહિતી આ વેબસાઈટ પરથી મેળવી શકાય છે, [brampton.ca/downtownreimagined](http://brampton.ca/downtownreimagined).

-30-

**બ્રામ્પટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે.** આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે કંપાયમાન શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે તક પ્રજ્વલિત કરે છે અને અહીં રહેતા અને કાર્યરત લોકોમાં ગૌરવ રેડીએ છીએ. આપણે બ્રામ્પટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુરસામય શહેર બનાવે. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://facebook.com/brampton) પર અનુસરો. [www.brampton.ca](http://www.brampton.ca) પર વધુ માહિતી જાણો.

**મીડિયા સંપર્ક (MEDIA CONTACT)**

નાટાલી સ્ટોગડિલ (Natalie Stogdill)

મીડિયા કોર્ડિનેટર (Media Coordinator)

સીટી ઓફ બ્રામ્પટન (City of Brampton)

905.874.3654 | [natalie.stogdill@brampton.ca](mailto:natalie.stogdill@brampton.ca)